

કોમર્શિયલ સુટ નં.૦૭/૨૦૨૫ ના કામે આંક-૧ નીચે હુકમ.

આ કામના પક્ષકારોએ આંક-૧૭ ની કરારદાદની પુરસીસ થી દાવાની વિષય-વસ્તુ અંગે સમાધાન રજુ કરેલ છે. સદરહુ સમાધાન પુરસીસ પક્ષકારોને તેમના વકીલશ્રીઓની હાજરીમાં વાંચી સંભળાવતા પક્ષકારોએ તે કબુલ મંજૂર રાખેલ છે. સમાધાનને બીજો કોઈ કાયદાકીય બાધ નડતો ન હોય, સમાધાન જેન્યુન જણાતું હોય, સમાધાનની હકીકતે આ દાવો ફેંસલ કરવામાં આવે છે અને તે રીતે નીચે મુજબનો હુકમ કરવામાં આવે છે.

"કરારદાદની પુરસીસ એ રીતની રજુ કરેલ છે કે,"

આ કામમાં પક્ષકારોની માનસાથ નમ્ર અરજ કે, ઉપરોક્ત દાવામાં પક્ષકારોએ પરસ્પર નીચે મુજબની શરતોથી સમાધાન નક્કી કરેલ છે.

- (૧) વાદી બેંક દ્વારા પ્રતિવાદીઓને કિસાન ક્રેડિટ કાર્ડ (**KCC**) યોજના હેઠળ કૃષિ ધિરાણ આપવામાં આવેલ હતું, જે ખાતું લોનની બાકીદારીને કારણે ભારતીય રિઝર્વ બેંકના પ્રચલિત નિયમો મુજબ **Non-Performing Asset (NPA)** તરીકે વર્ગીકૃત થયેલ છે.
- (૨) બંને પક્ષકારો વચ્ચે થયેલ પરસ્પર સમજૂતીના આધારે, વિવાદનો સંપૂર્ણ અને અંતિમ નિકાલ (**Full and Final Settlement**) રૂ.૩,૫૦,૦૦૦/- અંકે રૂપિયા ત્રણ લાખ પચાસ હજાર પુરાની રકમમાં સમાધાન કરવાનો સર્વાનુમતે નિર્ણય લેવામાં આવેલ છે.
- (૩) પ્રતિવાદી નં. ૨ તથા પ્રતિવાદી નં. ૩ સંયુક્ત રીતે તેમજ વ્યક્તિગત રીતે (**Jointly and Severally**) આથી બિનશરતી સ્વીકારે છે કે તેઓ પૈકી કોઈપણ એક અથવા બંને મળીને ઉપરોક્ત સમાધાનની સંપૂર્ણ રકમ તા. ૩૧/૧૦/૨૦૨૬ સુધીમાં ગુજરાત ગ્રામિણ બેંક, જાયવા શાખામાં જમા કરાવવાના રહેશે. અને વાદી બેંક દ્વારા તેની પહોંચ આપવામાં આવશે.
- (૪) પ્રતિવાદીઓ વધુમાં જાહેર કરે છે અને સ્વીકારે છે કે તેઓ એકબીજાના વતી (**on behalf of each other**) પણ ઉપરોક્ત સમાધાનની સંપૂર્ણ રકમ ચૂકવવા માટે કાયદેસર રીતે સંયુક્ત તથા વ્યક્તિગત રીતે જવાબદાર રહેશે અને કોઈપણ એક પ્રતિવાદી દ્વારા કરવામાં આવેલી ચુકવણી બંને પ્રતિવાદીઓની સંયુક્ત

જવાબદારીની ચુકવણી ગણાશે.

- (પ) વાદી બેંક દ્વારા સમાધાનની સંપૂર્ણ રકમ પ્રાપ્ત થયા બાદ, વાદી બેંક નીતિઓ તથા લાગુ પડતા કાયદાકીય પ્રાવધાનો અનુસાર ખાતાનું સમાધાન પૂર્ણ થયેલ હોવાનું નોંધશે. અને **NOC** આપવાની રહેશે.
- (ડ) જો પ્રતિવાદીઓ ઉપરોક્ત નિર્ધારિત સમયમર્યાદા એટલે કે તા. ૩૧/૧૦/૨૦૨૬ સુધીમાં સમાધાનની સંપૂર્ણ રકમ ચૂકવવામાં નિષ્ફળ જશે, તો આ સંમતિનામું કોઈ અલગ નોટિસ, માંગણી અથવા કાર્યવાહી વિના આપોઆપ રદ થયેલ ગણાશે. આવી સ્થિતિમાં વાદી બેંકને મૂળ દાવામાં દર્શાવેલ સંપૂર્ણ બાકી લેણું, કરાર મુજબનું વ્યાજ સહિત, તથા હુકમનામાની અમલવારી સહિતની તમામ કાયદેસરની કાર્યવાહી કરવાનો અબાધિત અધિકાર રહેશે.
- (૭) પ્રતિવાદીઓ આથી વધુમાં જાહેર કરે છે કે તેઓ આ સંમતિનામા હેઠળ કોઈપણ પ્રકારનો વિવાદ, વાંધો અથવા બચાવ ભવિષ્યમાં રજૂ કરશે નહીં તથા આ સંમતિની શરતો તેમના તેમજ તેમના વારસદારો, કાનૂની પ્રતિનિધિઓ, ઉત્તરાધિકારીઓ તથા મિલકત ઉપર સંપૂર્ણપણે બંધનકર્તા રહેશે.
- (૮) પક્ષકારો આથી જાહેર કરે છે કે આ સંમતિનામું કોઈપણ પ્રકારના દબાણ, ગેરરજૂઆત, કપટ, અયોગ્ય પ્રભાવ અથવા બળજબરી વિના, સ્વૈચ્છિક રીતે તથા તેની તમામ શરતો વાંચી, સમજી અને સ્વીકારીને કરવામાં આવેલ છે.
- (૯) તેથી આપ સાહેબને નમ્ર અરજ છે કે આ સંમતિની શરતોને રેકૉર્ડ પર લઈ, તે મુજબ **Consent Decree** પસાર કરવા તથા દાવાનો નિકાલ કરવા હુકમ કરવા નમ્ર અરજ છે.

ઉપર મુજબ કરારદાદની પુરસીસથી રેકૉર્ડ પર જરૂરી હુકનામું કરવા પક્ષકારો સંમત અને ખુશ છે.

::- હુકમ -::

- ૧). આ કામના પક્ષકારોએ આંક-૧૭ ની સમાધાનની પુરસીસ થી દાવાની વિષય-વસ્તુ અંગે સમાધાન રજૂ કરેલ છે. સદરહુ સમાધાન પુરસીસ પક્ષકારોને તેમના વકીલશ્રીઓની હાજરીમાં વાંચી સંભળાવતા પક્ષકારોએ તે કબુલ મંજૂર રાખેલ છે સદર સમાધાન પક્ષકારો એ રાજી-ખુશીથી, કોઈપણ જાતના દબાણ વિના સ્વેચ્છાએ કરેલ છે અને જે બદલ આ નીચે સહી કરેલ છે અને પક્ષકારોએ કબુલ-મંજૂર અને બંધનકર્તા છે અને રહેશે.

સદર સમાધાનને બીજો કોઈ કાયદાકીય બાધ નડતો ન હોય, સમાધાન જેન્યુન જણાતું હોય, સમાધાનની હકીકતે આ દાવો ફેંસલ કરવામાં આવે છે

- ૨). દાવાનું ખર્ચ પક્ષકારોએ પોતપોતાનું પોતે ભોગવવું.
- ૩). નીયમ અનુસાર કોર્ટ ફી રીફંડ સર્ટીફિકેટ વાટી ના નામનું આપવું.
- ૪). આંક-૧૭ ની સમાધાનની પુરસીસ મુજબનું હુકમનામું દોરવું.

ઉપરોક્ત હુકમ આજ રોજ તા.૧૧, માહે-જુલાઈ, સને-૨૦૨૬ ના રોજ લોક અદાલતમાં વાંચી, સંભળાવી, મારી સહી કરીને જાહેર કર્યો.

જામનગર.

તા.૧૧-૦૭-૨૦૨૬

(એન.જી.પરમાર)

પ્રિન્સીપાલ સિનિયર સિવિલ જજ

જામનગર.

કોડ નં.જે.જી.૦૦૮૫૯